

**MD-101**

May-2022

**B.Sc., Sem.-IV****CC-205 : Chemistry****(Analytical Chemistry)****Time : 2 Hours]****[Max. Marks : 50**

- સૂચનાઓ : (1) વિભાગ-Iના બધા પ્રશ્નોના ગુણ સરખા છે.  
 (2) વિભાગ-Iમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના ઉત્તર લખો.  
 (3) વિભાગ-IIનો પ્રશ્ન નં.9 ફરજિયાત છે.  
 (4) વિભાગ-IIમાં કોઈપણ આઠ પ્રશ્નોના જવાબ લખવા.

**વિભાગ – I**

1. (A) III-B સમૂહના ધન આયનોનું સલ્ફાઈડરૂપે અલગીકરણ સમજાવો. 7  
 (B) રેડોક્ષ અનુમાપનમાં અંતિમ બિંદુ શોધવા માટેની દૃશ્યમાન પદ્ધતિની ચર્ચા કરો. 7
2. (A) 50 મિલી 0.1 M FeSO<sub>4</sub>ના જલીય દ્રાવણનું 0.1 M Ce(SO<sub>4</sub>)<sub>2</sub> સાથે અનુમાપન કરવામાં આવે છે. આ અનુમાપનની શરૂઆત અને 10, 30, 50 તથા 80 મિલી 0.1 M Ce(SO<sub>4</sub>)<sub>2</sub> નાખતા થતાં ઈ.એમ.એફ.ની ગણતરી કરો. 7  
 (B) III-A સમૂહના ધન આયનોનું હાઈડ્રોક્સાઈડ રૂપે અલગીકરણ સમજાવો. 7
3. (A) પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝ વચ્ચેનું અનુમાપન દૃશ્યમાન અને pH પદ્ધતિથી સમજાવો. 7  
 (B) નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝ વચ્ચેનું અનુમાપન pH પદ્ધતિથી સમજાવો. 100 મિ.લી. 0.1 M CH<sub>3</sub>COOHનું અનુમાપન 0.1 M NH<sub>4</sub>OH સાથે કરતાં સમતુલ્ય બિંદુએ pHની ગણતરી કરો. 7
4. (A) 100 મિલી 0.01 M HCl ના દ્રાવણનું 0.01 M NaOH સાથે અનુમાપન કરવામાં આવે છે. આ અનુમાપનની શરૂઆતમાં અને ત્યાદબાદ 20, 50, 100 અને 110 મિલી 0.01 M NaOHનું દ્રાવણ નાખતા કેટલી pH થશે તેની ગણતરી કરો. 7  
 (B) નિર્બળ એસિડ અને પ્રબળ બેઈઝનું અનુમાપન દૃશ્યમાન પદ્ધતિથી સમજાવો. 7
5. (A) વોલ્ટાઈડ પદ્ધતિ સમજાવો. 7  
 (B) EDTA અનુમાપનના પ્રકાર સમજાવો. 7

6. (A) મોહરની પદ્ધતિ સમજાવો. 7  
 (B) ઈરિયોકોમ બ્લેક T વિશે ચર્ચા કરો. 7
7. (A) ક્યુપ્રોન, ડાયમિથાઈલ ગ્લાયકોઝાઈમ અને કપફેરોનના ઉપયોગો વર્ણવો. 7  
 (B) કાર્બનિક અવક્ષેપનના ફાયદાઓ અને ગેરફાયદાઓ જણાવો. 7
8. (A) ભારમાપક અવક્ષેપનમાં વપરાતી ટર્મ સમજાવો : 7  
 (a) કો-અવક્ષેપન  
 (b) પેપ્ટાઈઝેશન અને  
 (c) અવક્ષેપનના એર્જીંગ  
 (B) વોન વેમન્સ સમીકરણની વિસ્તારથી ચર્ચા કરો. 7

## વિભાગ - II

9. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો : (કોઈપણ આઠ) 8
- (1) દ્રાવ્યતા ગુણાકારની વ્યાખ્યા લખો.
  - (2) કોઈપણ એક રેડોક્ષ સૂચકનું નામ લખો.
  - (3)  $Ca^{+2}$  આયન શોધવા માટેનો કોઈપણ એક ટેસ્ટ લખો.
  - (4) આયોડોમિતિની વ્યાખ્યા લખો.
  - (5) 0.001 M NaOHના દ્રાવણની pH ગણો.
  - (6) મિથાઈલ રેડ સૂચક માટે pH મર્યાદા કેટલી હોય છે ?
  - (7) પ્રાથમિક પ્રમાણિતની વ્યાખ્યા લખો.
  - (8) 25 °C તાપમાને  $K_w$  ની કિંમત કેટલી હોય છે ?
  - (9) માર્સ્કીંગ એજન્ટનો ઉપયોગ શું છે ?
  - (10) EDTAનું આખું નામ લખો.
  - (11) મોહર પદ્ધતિમાં કયો સૂચક વપરાય છે ?
  - (12) અવક્ષેપન અનુમાપનની વ્યાખ્યા લખો.
  - (13) ડાયથાયાઝોનનું બંધારણ દોરો.
  - (14) એર્જીંગની વ્યાખ્યા લખો.
  - (15) પેપ્ટાઈઝેશન એટલે શું ?
  - (16) ધોવાણની વ્યાખ્યા લખો.

Seat No. : \_\_\_\_\_

# MD-101

May-2022

B.Sc., Sem.-IV

CC-205 : Chemistry  
(Analytical Chemistry)

Time : 2 Hours]

[Max. Marks : 50

- Instructions :**
- (1) All questions in Section-I carry equal marks.
  - (2) Attempt any **three** questions in Section-I.
  - (3) Question-9 of Section-II is compulsory.
  - (4) Attempt any **eight** questions in Section-II.

## SECTION – I

1. (A) Explain separation of III-B group cations precipitated as sulphide. 7  
(B) Discuss ways of locating the end point for Redox titration by Visual Method. 7
2. (A) 50 ml 0.1 M  $\text{FeSO}_4$  aqueous solution is titrated against 0.1 M  $\text{Ce}(\text{SO}_4)_2$  solution. Calculate the emf at the start and after addition of 10, 30, 50 and 80 ml 0.1 M  $\text{Ce}(\text{SO}_4)_2$  solution. 7  
(B) Explain separation of III-A group cations as hydroxides. 7
3. (A) Explain titration of strong Acid and strong Base by visual and pH method. 7  
(B) Explain titration of weak acid and weak base by pH metry method and 100 ml 0.1 M  $\text{CH}_3\text{COOH}$  is titrated against 0.1 M  $\text{NH}_4\text{OH}$ . Calculate pH at equivalence point. 7
4. (A) 100 ml 0.01 M HCl is titrated against 0.01 M NaOH solution. Calculate the pH at the start and after adding 20, 50, 100 and 110 ml of 0.01 M NaOH solution. 7  
(B) Explain titration of weak acid and strong base by visual method. 7
5. (A) Explain Volhard's method. 7  
(B) Explain types of EDTA Titration. 7

- |    |  |   |
|----|--|---|
| 6. | (A) Explain Mohr's Method.   | 7 |
|    | (B) Discuss about Eriochrome black T.                                  | 7 |
| 7. | (A) Describe the uses of Cupron, Dimethyl glyoxime and Cupferron.      | 7 |
|    | (B) Mention the advantages and disadvantages of organic precipitation. | 7 |
| 8. | (A) Explain terms used in Gravimetric Precipitation :                  |   |
|    | (a) Co-precipitation   |   |
|    | (b) Peptization  |   |
|    | (c) Ageing of precipitates   | 7 |
|    | (B) Discuss about Von Weimarn's equation.                              | 7 |

### SECTION – II

- |    |   |          |
|----|---|----------|
| 9. | Answer the following questions in short : (any <b>eight</b> ) | <b>8</b> |
|    | (1) Define Solubility product.                                |          |
|    | (2) Give example of any one Redox indicator.                  |          |
|    | (3) Write any one test for finding $\text{Ca}^{+2}$ ion.      |          |
|    | (4) Define Iodometry.   |          |
|    | (5) Calculate pH of 0.001 M NaOH solution.                    |          |
|    | (6) What is the pH range for Methyl Red indicator ?           |          |
|    | (7) Define Primary Standard.                                  |          |
|    | (8) Write $K_w$ value at $25^\circ\text{C}$ .                 |          |
|    | (9) What is the use of Masking Agents ?                       |          |
|    | (10) Write full form of EDTA.                                 |          |
|    | (11) Which indicator is used in Mohr's Method ?               |          |
|    | (12) Define Precipitation titration.                          |          |
|    | (13) Draw structure of Dithiozone.                            |          |
|    | (14) Define Ageing.   |          |
|    | (15) What is Peptization ?                                    |          |
|    | (16) Define washing.  |          |
-